



શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વાવ.(ગુજરાતી માધ્યમ)
દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિષયવાર માળખાં અને પરીક્ષાનું સમયપત્રક – 2024
ધોરણ-7

વિષય	માળખાં
ગણિત	અભ્યાસક્રમ :- 8 to 15 કુલ ગુણ : 80 પ્રશ્ન 1 (અ) નીચે દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. [08] (બ) નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. [08] પ્રશ્ન 2 (અ) નીચેના વિધાનો ખરાં છે કે ખોટા તે લખો. [08] (બ) નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દ કે વાક્યમાં આપો. [08] પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના જવાબ આપો. (ગમે તે આઠ) [16] પ્રશ્ન 4 (અ) નીચેના પ્રશ્નોના જવાબ આપો. (ગમે તે ચાર) [12] (બ) સાચાં જોડકાં બનાવો. [04] પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના જવાબ આપો. (ગમે તે ચાર) [16]
વિજ્ઞાન	અભ્યાસક્રમ :- 6,7,8,10,11,13 કુલ ગુણ : 80 પ્રશ્ન 1 (અ) નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. [05] (બ) માગ્યા પ્રમાણે જવાબ આપો. (1) તફાવત આપો. (ગમે તે એક) [03] (2) વ્યાખ્યા આપો. (ગમે તે ત્રણ) [06] (ક) ટૂંકનોંધ લખો. (ગમે તે બે) [08] પ્રશ્ન 2 (અ) નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો. [05] (બ) માગ્યા પ્રમાણે જવાબ આપો. (1) વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. (ગમે તે બે) [06] (2) નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. [03] (ક) નીચેના પ્રયોગો/પ્રવૃત્તિનું આકૃતિ દોરી વર્ણન કરો. (ગમે તે બે) [08] પ્રશ્ન 3 (અ) નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે કહો. [05] (બ) આપેલા પ્રયોગના સાધનોની યાદી બનાવો. [02] (ક) નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. (ગમે તે ત્રણ) [12] પ્રશ્ન 4 (અ) નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર લખો. [05] (બ) નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (ગમે તે પાંચ) [10] (ક) વર્ગીકરણ કરો. [02]
ગુજરાતી	અભ્યાસક્રમ :- 11 to 21, વ્યાકરણ, નિબંધલેખન, વિચાર-વિસ્તાર, અખબારી નોંધ કુલ ગુણ : 80 પ્રશ્ન-1 [અ] નીચેના પ્રશ્નોનાં એક વાક્યમાં જવાબ આપો. [06] [બ] જોડકાં જોડો. [05] [ક] કાવ્યપંક્તિ પૂર્ણ કરો. [04] પ્રશ્ન-2 [અ] નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાક્યોમાં જવાબ આપો. (ગમે તે ત્રણ) [06] [બ] નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. (ગમે તે બે) [08] [ક] નીચેની જાહેરાત વાંચીને પ્રશ્નોના જવાબ લખો. [05] પ્રશ્ન-3 [અ] નીચેનાં પ્રશ્નોનાં ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો. (ગમે તે બે) [06] [બ] પાત્રાલેખન કરો. (ગમે તે બે) [06] પ્રશ્ન-4 સૂચના પ્રમાણે કરો. [1] નીચેના શબ્દોનાં સમાનાર્થી શબ્દ લખો. (ગમે તે બે) [02] [2] નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો. (ગમે તે બે) [02] [3] નીચેના શબ્દોની સાચી જોડણી લખો. (ગમે તે બે) [02] [4] રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય લખો. (ગમે તે એક) [01] [5] શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. (ગમે તે એક) [01] [6] નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધો. [02] [7] નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ ઓળખી તેનો પ્રકાર લખો. [02] [8] નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો. [03] [9] નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. [02] પ્રશ્ન 5 [અ] અખબારી નોંધ [05] [બ] વિચાર-વિસ્તાર કરો. [05] [ક] કોઈ પણ એક વિષય પર નિબંધ લખો. [07]
સામાજિક વિજ્ઞાન	અભ્યાસક્રમ :- 5,6,12,7,16,8,13,17,18 કુલ ગુણ : 80 પ્રશ્ન 1 [અ] નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. [05] [બ] બંધબેસતા જોડકાં રચો. [05] પ્રશ્ન 2 [અ] યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. [05] [બ] નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. [05] પ્રશ્ન 3 [અ] નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખો. (ગમે તે સાત) [14] [બ] શબ્દોની સમજ આપો. (ગમે તે ત્રણ) [06] પ્રશ્ન 4 [અ] નીચેના પ્રશ્નોનાં એક વાક્યમાં જવાબ આપો. (ગમે તે આઠ) [08] [બ] કારણ આપી વિધાનો પૂરા કરો. (ગમે તે ચાર) [12] પ્રશ્ન 5 [અ] નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. (ગમે તે બે) [08] [બ] ટૂંકનોંધ લખો. (ગમે તે બે) [08] [ક] તમને આપવામાં આવેલા ભારત દેશના રેખાંકિત નકશામાં નીચે આપેલી વિગતો યોગ્ય સંજ્ઞા કે નામ વડે દર્શાવો. [04]
ENGLISH	Syllabus: 1 to 5, prose-1 to 3, grammar-1 to 5, essay, composition. Total Marks: 80 Que: 1 (A) Answer the following question. [05] (B) Say “True” or “False”. [05] (C) Who said to whom. [05] Que: 2 (A) Fill in the blanks with proper preposition from those given in the brackets. [05] (B) Fill in the blanks with correct articles “a/an/the”. [05] (C) Fill in the blanks with the proper word from those given in the brackets. [05] Que: 3 (A) Fill in the blanks with proper conjunctions. [and, or, otherwise, but, therefore, so] [05] (B) Fill in the blanks using the proper infinitive from those given in the bracket below. [05]

	(C) Fill in the blanks using proper word from “one”, “the other” and “each other”[05] Que:4(A) Fill in the blanks with proper word from those given in the brackets(adverb).[05] (B) Fill in the blanks with proper interrogative pronoun from those given in the brackets. [05] (C) Read the paragraph and answer the following question.[05] (D) Fill in the blanks using the words given in the brackets.(Dialogue writing)[05] Que:5 (A) Read the data and answer the questions.[05] (B) Write any one letter. [05] (C) Write any one essay. [05]
સંસ્કૃત	અભ્યાસક્રમ :- 1 to 7, વ્યાકરણ કુલ ગુણ : 80 પ્રશ્ન-1(અ) નીચે આપેલ પ્રશ્નનો સાચો જવાબ વિકલ્પમાંથી શોધીને લખો. (05) (બ) નીચે આપેલ ખાલી જગ્યા પૂરો. (06) (ક) નીચે આપેલ વિધાન ખરાં છે કે ખોટાં તે જણાવો. (06) (ડ) નીચે આપેલ જોડકાં જોડો. (05) પ્રશ્ન-2 (અ) નીચે આપેલ પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં લખો. (07) (બ) નીચે આપેલ પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. (05) (ક) નીચેના વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો. (05) પ્રશ્ન-3 (અ) નીચે આપેલ શ્લોક પૂર્ણ કરો. (04) (બ) નીચે આપેલ શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કરો. (04) (ક) નીચે આપેલ ગદ્યખંડનું ગુજરાતીમાં ભાષાંતર કરો. (06) પ્રશ્ન-4 (અ) નીચે આપેલ ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરો. (04) (બ) નીચે આપેલ એકવચન વાક્યોનું બહુવચનમાં રૂપાંતર કરો.(04) (ક) નીચે આપેલી સૂક્તિનો અનુવાદ કરી તેનો ભાવાર્થ લખો. (ગમે તે એક) (03) પ્રશ્ન-5 સુચના પ્રમાણે કરો. (1) નીચે આપેલ સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો લખો. (03) (2) નીચે આપેલ સંસ્કૃત શબ્દોના વિરોધી શબ્દો લખો. (03) (3) નીચે આપેલ શબ્દોની સંધિ છોડો. (02) (4) નીચે આપેલ શબ્દોની સંધિ જોડો. (02) (5) નીચે આપેલ સંસ્કૃત શબ્દોનો સાચો અર્થ વિકલ્પમાંથી શોધીને લખો. (04) (6) નીચે આપેલ ગુજરાતી શબ્દોનો સંસ્કૃત શબ્દ લખો. (02)
હિન્દી	અભ્યાસક્રમ :- 1 to 10, નિબંધ પત્ર, કહાની, પુનરાવર્તન કસોટી ૧-૨, વ્યાકરણ, ગદ્યખંડ કુલ ગુણ : 80 પ્રશ્ન 1 (અ) નિમ્નલિખિત પ્રત્યેક પ્રશ્ન કે લિખ દિવે ગવ વિકલ્પોં મે સે સહી વિકલ્પ ચુનકર લિખિય: [05] (બ) નિમ્નલિખિત પ્રશ્નોં કે ઉતર ઁક-ઁક વાક્ય મેં લિખિય: (ગદ્ય) [06] (ક) નિમ્નલિખિત પ્રશ્નોં કે ઉતર ઁક-ઁક વાક્ય મેં લિખિય: (પદ્ય) [05] પ્રશ્ન 2 (અ) નિમ્નલિખિત પ્રશ્નોં કે ઉતર ઁ-તીન વાક્યોં મેં લિખિય: (ગદ્ય) [08] (બ) નિમ્નલિખિત રિક્તસ્થાનોં કી પૂર્તિ કીજિય: (ગદ્ય) [05] (ક) નિમ્નલિખિત મુહાવરોં કા અર્થ ઁકર વાક્ય-પ્રયોગ કીજિય: (તીન મેં સે ઁ) [04] (ડ) નિમ્નલિખિત શ્બ્દોં કો શબ્દકોશ-ક્રમ મેં લિખિય: [02] (ઁ) નિમ્નલિખિત શ્બ્દોં કો ઉચિત ક્રમ મેં રચકર અર્થપૂર્ણ વાક્ય બનાઁય: [02] (ઈ) નિમ્નલિખિત ઉક્તિ, કૌન કિસે કહતા હૈ, લિખિય: [02] પ્રશ્ન 3 (અ) નિમ્નલિખિત પ્રશ્નોં કે ઉતર ઁ-તીન વાક્યોં મેં લિખિય: (પદ્ય) [06] (બ) કાવ્યપંક્તિયૌં પૂર્ણ કીજિય : (કિન્હી ઁક) [04] પ્રશ્ન 4 (અ) શબ્દ સમૂહ કે લિખ ઁક શબ્દ લિચે [02] (બ) નિમ્નલિખિત શબ્દોં કા વચન પરિવર્તન કીજિય : [02] (ક) નિમ્નલિખિત વાક્યોં મેં સે વિશેષણ પહચાનકર ઁસકા પ્રકાર લિખિય : [02] (ડ) નિમ્નલિખિત શબ્દોં કા સમાનાર્થી શબ્દ લિખિય : [02] (ઁ) નિમ્નલિખિત શબ્દોં કા વિરુધ્ધાર્થી શબ્દ લિખિય : [02] (ઈ) નિમ્નલિખિત વાક્યોં કા કાલ પહચાનકર લિખિય : [02] પ્રશ્ન 5 (અ) નિમ્નલિખિત વિષયોં મેં સે કિસી ઁક વિષય પર નિબંધ લિખિય: [08] (બ) નિમ્નલિખિત રુપરેચા કે આધાર પર કહાની લિચકર ઁસે ઉચિત શીર્ષક ઁજિય: [05] અથવા (બ) નિમ્નલિખિત વિષય પર પત્રલેચન કીજિય: (ક) નિમ્નલિખિત પરિચ્છેદ કો પઁકકર પ્રશ્નોં કે ઉતર લિખિય: [06]
કમ્પ્યૂટર	અભ્યાસક્રમ : સંપૂર્ણ કુલ ગુણ: 30 ❖ નીચે આપેલા વૈકલ્પિક પ્રશ્નનો સાચો વિકલ્પ શોધીને OMR ઉત્તર પત્રકમાં લખો.(ઁરેકનો ઁક ગુણ) [30]
ચિત્રકામ	અભ્યાસક્રમ : સંપૂર્ણ કુલ ગુણ: 80 વિભાગ – A (થીયરી) પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. (MCQ પ્રકારના પ્રશ્નો રહેશે.) (ઁરેક પ્રશ્નનો1ગુણ) (ઁરેક પ્રશ્ન ઁરજિયાત રહેશે.) [30] વિભાગ- B (પ્રાયોગિક) નીચે આપેલા વિષયોમાંથી કોઈઁક વિષય પસંદ કરી સુંઁર ઁરીને રંગ કાર્ય કરો. (જળરંગોનો ઉપયોગ કરવાનો રહેશે) [50]
સ્વા. અને શા.શિ.	અભ્યાસક્રમ : સંપૂર્ણ કુલ ગુણ: 30 ❖ નીચે આપેલા વૈકલ્પિક પ્રશ્નનો સાચો વિકલ્પ શોધીને OMR ઉત્તર પત્રકમાં લખો.(ઁરેકનો ઁક ગુણ) [30]

વિદ્યાર્થી મિત્રો “પરીક્ષા ઉત્સવ છે, ઉત્સાહથી ઉજવો.” વાંચન +મનન +લેખન =સફળતા

દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક – 2024

Std-7

તારીખ	02-04-24	03-04-24	04-04-24	05-04-24	06-04-24	08-04-24	09-04-24	11-04-24	12-04-24	13-04-24
વાર	મંગળવાર	બુધવાર	ગુરુવાર	શુક્રવાર	શનિવાર	સોમવાર	મંગળવાર	ગુરુવાર	શુક્રવાર	શનિવાર
વિષય	સ્વા.અને શા.શિ.	કમ્પ્યુટર	ચિત્રકલા	સા.વિજ્ઞાન	ગુજરાતી	ગણિત	સંસ્કૃત	અંગ્રેજી	હિન્દી	વિજ્ઞાન ટેકનોલોજી
સમય	11:00 am to 01:30 pm									

નોંધ :-

- ❖ દ્વિતીય સત્રાંત પરીક્ષાનો અભ્યાસક્રમ દ્વિતીય સત્રનો જ રહેશે અને દ્વિતીય સત્રાંત પરીક્ષા જે તે વિષયના માળખાં પ્રમાણે રહેશે.
- ❖ **Practice Round For Revision** દ્વિતીય સત્રાંત પરીક્ષાના માળખાં મુજબ રહેશે, જેનું સમયપત્રક અલગથી આપેલ છે.
 - ❖ પરીક્ષા દરમિયાન શાળા રાબેતા મુજબ શરૂ રહેશે અને પરીક્ષા શાળા સમય દરમિયાન લેવામાં આવશે.
 - ❖ પરીક્ષાના દિવસે જે વિષયની પરીક્ષા હોય તે વિષયના પુસ્તકો લાવવાના રહેશે.
- ❖ દ્વિતીય સત્રાંત પરીક્ષાનું આંતરિક મૂલ્યાંકન ધોરણ 6 થી 8 માં 20 ગુણનું રહેશે. જેનું સમયપત્રક વર્ગ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને અલગથી જણાવવામાં આવશે.
- ❖ આંતરિક મૂલ્યાંકનમાં હોમવર્ક, નોટબુક, યુનિટ ટેસ્ટ, હાજરી, અનુલેખન, શ્રુતલેખન, વિકલી ટેસ્ટ, વાંચન, ઘડિયા, સ્કૂલ ડાયરી અને સ્વયંશિસ્તને ધ્યાનમાં રાખીને જે - તે વિષયનું મૂલ્યાંકન કરવામાં આવશે.
- ❖ ધો. 6 થી 8 ચિત્રકલા, સ્વા. અને શા.શિ.(પી.ટી.)અને કમ્પ્યુટર ના વિષયની પ્રાયોગિક પરીક્ષા 50 ગુણની અને 30 ગુણની થીયરી MCQ પ્રકારની રહેશે અને 20 ગુણ આંતરિક મૂલ્યાંકનના રહેશે.
- ❖ પરીક્ષા દરમિયાન ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની પરીક્ષા અલગથી લેવામાં આવશે નહીં, પરીક્ષા માટેની જરૂરી વસ્તુઓ સાથે જ લાવવી.
- ❖ પરીક્ષા પૂર્ણ થયા બાદ તા.15/04/2024થી તા.30/04/2024 સુધી શાળા રાબેતા મુજબ શરૂ રહેશે, જેમાં શાળામાં સ્પોર્ટ્સ અને ક્લબ એક્ટિવિટીની પ્રવૃત્તિ કરાવવામાં આવશે, જેની નોંધ લેવી.
- ❖ વાર્ષિક પરીક્ષાનું પરિણામ :- નર્સરી થી ધો.9 તા. 03/05/2024 ને શુક્રવારના રોજ રહેશે.
- ❖ ઉનાળુ વેકેશન :- ધો.1 થી 8 તા. 04/05/2024 થી તા. 09/06/2024 સુધી રહેશે.
- ❖ નવા સત્રનો પ્રારંભ :- ધો.1 થી 9 તા.10/06/2024ને સોમવારથી શાળા રાબેતા મુજબ શરૂ થશે.

 *Best of luck!* 